

## ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો –૨૦૧૦

(૧) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દારા વિકસાવેલ /ભલામણ કરવામાં આવેલ વિવિધ પાકોની સુધારેલી / સંકર જાતોની માહિતી

### ૧.૧ મગફળી–જીજેજી–૮

ગુજરાત જૂનાગઢ મગફળી–૮ (જીજેજી–૮) જાતે ૩૦.૦ ટકા , ૨૦.૫ ટકા અને ૧૫.૫ ટકા ડોડવાનું વધુ ઉત્પાદન અનુક્રમે અંકુશ જાતો જીજી–૨, જીજી–૫ અને જીજી–૭ કરતા ચોમાસુ ઋતુમાં આપેલ છે. આ જાતે અંકુશ જાતો કરતા દાણા તથા તેલનું ઉત્પાદન પણ વધુ આપેલ છે. જીજેજી–૮ જાતે થડના સૂકારાના રોગ તથા તડતરીયા અને થ્રીપ્સ સામે સામાન્ય પ્રતિકારક શક્તિ દર્શાવેલ છે. આ જાતના ડોડવા તથા દાણાના મોટો કદ અને વધુ ઉત્પાદન ઉપરાંત દાણાની સારી ટકાવારીને લીધે રાજ્યમાં ચોમાસુ ઋતુમાં ઉભડી મગફળીના વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. સરેરાશ ડોડવાનું ઉત્પાદન ૧૬૩૨ ક્રિ.ગ્રા. / હે. છે.

(સંશોધન વૈજ્ઞાનિક(મગફળી), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

### ૧.૨ મગફળી–જીજેજી–૩૧

ગુજરાત જૂનાગઢ મગફળીની (જીજેજી–૩૧) જાતે ૨૬.૮ ટકા , ૨૪.૧ ટકા, ૧૭.૫ ટકા અને ૨૦.૬ ટકા ડોડવાનું વધુ ઉત્પાદન અનુક્રમે જીજી–૨, જીજી–૪, જીજી–૬ અને ટીજી–૨૬ જેવી અંકુશ જાતો કરતા આપેલ છે. આ જાત ડોડવા તથા દાણાના ગુણધર્મમાં અંકુશ જાતો કરતા ચઢીયાતી માલુમ પડેલ છે. તડતરીયા, લીલી ઈયળ અને અગ્રકલીકાના સૂકારાનો રોગ અંકુશ જાતો કરતા ઓછો માલુમ પડતા રાજ્યના ઉનાળું ઋતુમાં ઉભડી મગફળી વાવવા માટે ભલામણ કરવામાં આવે છે. સરેરાશ ડોડવાનું ઉત્પાદન ૩૪૮૩ ક્રિ./હે. છે.

(સંશોધન વૈજ્ઞાનિક(મગફળી), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

### ૧.૩ ગુજરાત જૂનાગઢ રીગણો–૨ (જીજેબી–૨)–

ગુજરાત રાજ્યમાં પાછોતરા ચોમાસા તથા શિયાળું ઋતુમાં રીગણનો પાક ઉગાડતા ખેડૂતોને રીગણની ગુજરાત જૂનાગઢ રીગણો–૨ (જીજેબી–૨) જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના રીગણનું ઉત્પાદન ૩૪૨.૮૪ કવીન્ટલ/હેક્ટર મળેલ છે. જે નિયંત્રિત જાત ગુજરાત લંબગોળ રીગણો–૧ કરતા ૨૦.૮૧ ટકા વધારે માલુમ પડેલ છે. આ જાતના રીગણના ફળો મધ્યમ લાંબા તથા મધ્યમ કદના ગુલાબી જાંબલી રંગના સારા ચળકાટવાળા થાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક(લ.ડુ.), શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

### ૧.૪ ગુજરાત જૂનાગઢ ભીડા – ૩ (જીજેઓ–૩)

ગુજરાત રાજ્યમાં ચોમાસુ ઋતુમાં ભીડાનો પાક ઉગાડતા ખેડૂતોને ભીડાની ગુજરાત જૂનાગઢ ભીડા – ૩ (જીજેઓ–૩) જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના ભીડાનું સૌથી વધુ ઉત્પાદન ૧૫૦.૫૨ કવીન્ટલ/હેક્ટર મળેલ છે. જે નિયંત્રિત જાતો ગુજરાત ભીડા–૨ તથા પુસા સાવની કરતા અનુક્રમે ૨૦.૬૨ તથા ૨૫.૬૬ ટકા વધારે માલુમ પડેલ છે. આ જાતના ભીડાની શીગો લીલી, કુમળી તથા આકર્ષક થાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક(લ.ડુ.), શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

## ૧.૫ ગુજરાત તલ-૪

તલની આ નવી જાત અમરેલી કેન્દ્ર ખાતેથી વિકસાવવામાં આવેલ છે. આ જાતે અંકુશ જાતો જેવી કે ગુજરાત તલ - ૨ અને ગુજરાત તલ - ૩ કરતાં અનુક્રમે ૧૮.૭ અને ૧૦.૮ ટકા વધુ ઉત્પાદન આપેલ છે. આ જાતનું એક દિવસીય તેલ ઉત્પાદન (કિલોગ્રામ/હે.) બન્ને અંકુશ જાતો કરતાં અનુક્રમે ૨૬.૨ અને ૧૬.૭ ટકા વધારે માલુમ પડેલ છે. સફેદ રંગના દાણાવાળી આ જાત નિકાસ માટે અનુકૂળ છે. બૈઢા કોરી ખાનાર ઈયણ, ગાંઠીયા માખી તથા લાલ કથીરી જેવી તલની અગત્યની જીવાતોના ઉપદ્રવની દ્રષ્ટિએ આ નવી જાત અને અંકુશ જાતો એક સમાન માલુમ પડેલ છે. તલની આ નવી વિકસાવેલ જાત બન્ને અંકુશ જાતો કરતા પાંચથી સાત દિવસ વહેલી પાકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકિય વિભાગ - ૬ ના વિસ્તારમાં વાવેતર માટે આ જાતની ભલામણ કરવામાં આવેલ છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન ૭૭૦ /- કિલોગ્રામ પ્રતિ હેક્ટાર માલુમ પડેલ છે.

(સંશોધન વૈજ્ઞાનિક (પાક સંવર્ધન), કૃષિ સંશોધન કેન્દ્ર, જૂક્યુ,, અમરેલી)

## ૧.૬ ગુજરાત સંકર દિવેલા-૬ બીજ ઉત્પાદનનાં પ્લોટમાં ઇથરેલ છંટકાવ કરવાથી માદા ફૂલોની સંખ્યામાં વધારો

ગુજરાત સંકર દિવેલા-૬ નું બીજ ઉત્પાદન કરતા ખેડૂતો તથા બીજ ઉત્પાદકોને ભલામણ કરવામાં આવે છે કે સંકર બીજ ઉત્પાદનનાં પ્લોટમાં માદા (જે.પી.-૬૫) લાઇનોમાં વાવેતર પછી ૪૫ અને ૬૫ દિવસે ઇથરેલ ૦.૦૫ ટકા પ્રમાણે બે છંટકાવ કરવાથી માદા જાતમાં માદા ફૂલોની વચ્ચે આવતા નર ફૂલોની સંખ્યામાં સાર્થક પ્રમાણમાં ઘટાડો થાય છે અને તે દ્રારા સ્વફલીનીકરણનું પ્રમાણ ઘટાડીને ઓછા ખર્ચે સંકર બીજ ઉત્પાદન લઈ શકાય છે અને હેક્ટારે વધુ આવક મેળવી શકાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક , બાજરા સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જામનગર)

(૨) ધાન્ય પાકો

૨.૧ બાજરી

(ક) બાજરા-ઘઉ પાક પદ્ધતિમાં રાસાયણિક ખાતર સાથે જૈવિક ખાતરોનો ઉપયોગ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવા વિસ્તારમાં બાજરી ( ચોમાસુ ) – ઘઉ (શિયાળુ) પાક પદ્ધતિ અનુસરતા ખેડૂતોને મહત્તમ નફો મેળવવા બંને પાકમાં ભલામણ કરેલ ખાતરના જથ્થા સાથે ૨૦ કિ.ગ્રા. પોટાશ તત્વ આપવું જો ખેડૂતો પાસે છાણીયું ખાતર ઉપલબ્ધ હોય તો બંને પાકમાં ભલામણ કરેલ ખાતરના જથ્થા સાથે ૫ ટન છાણીયું ખાતર અને જૈવિક ખાતર (૧ પેકેટ બંનેના) બંને પાકમાં આપવાથી લગભગ સરખો નફો મેળવી શકાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક (કૃષિ વિજ્ઞાન), બાજરા સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જામનગર)

#### **(ખ) ચારા માટેની જુવારમાં સાંઠાની માખીનું નિયંત્રણ**

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ ઋતુમાં ચારાની જુવારનું વાવેતર કરતાં ખેડૂતોને સાંઠાની માખીના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૭૦ ટકા પાણીમાં દાવ્ય ૫ કિલો/હે મુજબ બીજ માવજત અનેપ ટકા લીબોળીના બીજના અર્કના બે છંટકાવ ઉગાવા પછી પ્રથમ ૭ દિવસે અને બીજો ૧૮ દિવસે કરવાની સલાહ આપવામાં આવે છે.

(મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (ક્રીટક), ગૌચર સંશોધન કેન્દ્ર, જૂક્યુ, ધારી)

#### **(ક) બાજરીના સાંઠાની માખી અને ગાભમારાની ઈયળનું નિયંત્રણ**

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના બાજરો ઉગાડતા ખેડૂતોને સાંઠાની માખી અને ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે એન્ડોસલ્ક્ષાન ૦.૦૭ ટકા અથવા પ્રોફેનોફોસ ૦.૦૫ ટકા અથવા ફેનોબ્યુકાર્બ ૦.૧ ટકા નો બાજરાના ઉગાવાના ૨૦ અને ૪૦ દિવસે બે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક (ક્રીટક), બાજરા સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જામનગર)

#### **(ઢ) તેલીબિયાં પાકો**

૩.૧ મગફળી

#### **(ક) ચોમાસુ મગફળીમાં નીદણ નિયંત્રણ**

આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ મગફળી ઉગાડતા ખેડૂતોને આથી ભલામણ કરવમાં આવે છે કે વધારે ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવવા પાકને નીદણ મુક્ત રાખવા ૨૦ અને ૪૦ દિવસે બે હાથ નીદણ અને આંતર ખેડ કરવી. ખેત મજૂરોની અછિતની પરિસ્થિતીમાં પાક વાવ્યા બાદ તૂરત (ઉગ્યા પહેલા) નીદણનાશક દવા પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ + મગફળી ૨૦ દિવસની થાય ત્યારે ક્રીડાલોકોપ ઈથાઈલ દવા ૦.૦૫ કિ.ગ્રા. સક્રિય તત્વનો છંટકાવ કરવો અથવા મગફળી ઉગ્યા પહેલા પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્વ મગફળી ૨૦ દિવસની થાય ત્યારે ઈમીઝેથાફાયર ૦.૦૭૫ કિ.ગ્રા. સક્રિય તત્વ રૂપે છંટકાવ કરવો.

(સંશોધન વૈજ્ઞાનિક (કૃષિ વિજ્ઞાન), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

#### **(ખ) મગફળી જીજી-૫ જાતની વાવેતર માટે ભલામણ**

આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ઉભડી મગફળી ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે વધારે ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવવા નીચે મુજબની જાતોને અનુક્રમ પ્રમાણે અશ્રીમતા આપી વાવેતર કરવું. મગફળીની જાતોનો અનુક્રમ : જીજી-૫, જીજી-૨, જે-૧૧, જીજી-૭ અને ટીજી-૩૭ એ.

(સંશોધન વૈજ્ઞાનિક(મગફળી), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

### **(ગ) ચોમાસુ મગફળીમાં શ્રીપસ અને લીલી પોપટીનું નિયંત્રણ**

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ મગફળીની ખેતી કરતા ખેડૂતોને મગફળી પાકમાં શ્રીપસ અને લીલી પોપટી જીવાતના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુ એસ ૧ ગ્રામ/કિલો બીજ અથવા ઈભીડાકલોપ્રીડ ૬૦૦ એફએસ ઉ ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત અથવા ડાયમિથોએટ ઉંઠ ૩૦ ઈસી ૨ મિ.લિ. પ્રતિ લિટર પાણીમાં લેળવી વાવેતર પણી ૧૫ અને ૩૦ દિવસના અંતરે બે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક(કિટક), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

### **(ઘ) ચોમાસુ મગફળીમાં શ્રીપસનું નિયંત્રણ**

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ મગફળીની ખેતી કરતા ખેડૂતોને મગફળી પાકમાં શ્રીપસ જીવાતના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે પ્રોફેનોઝોસ ૪૦ ટકા સાયપરમેશ્વીન ૪ ટકા ૦.૦૪૪ ટકા (પોલીટ્રીન ૪૪ ઈસી) અથવા થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુ જી ૦.૦૦૬ ટકા અથવા ઈભીડાકલોપ્રીડ ૧૭.૮ એસ એલ ૦.૦૦૫ ટકા અથવા મિથાઈલ- ઓ- ડિમેટોન ૨૫ ઈસી ૦.૦૨૫ ટકા અથવા એન્ડોસલ્ફાન ૩૫ ઈસી ૦.૦૭ ટકા પ્રમાણે દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક(કિટક), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

### **(ચ) મગફળીમાં ટ્રાયકોડર્મા વીરડીનો ઉપયોગ**

આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મગફળી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, મગફળીમાં આવતા થડના કોહવારા (સ્ટેમ રોટ) ના રોગને અટકાવવા માટે ટ્રાયકોડર્મા વિરડી પાવડરની બીજ માવજત ૧ કિ.ગ્રા. બીજમાં ૧૦ ગ્રામ પ્રમાણે આપવી અથવા ટ્રાયકોડર્મા વિરડી પાવડરને ૩૦ દિવસની મગફળી થયા બાદ પાણી સાથે ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં આપવી. અથવા ૨.૫ કિ.ગ્રા. ટ્રાયકોડર્મા વિરડી પાવડર પ્રતિ હેક્ટરે વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. દેશી ખાતર અથવા અરેંડાના ખોળસાથે આપવો.

(સંશોધન વૈજ્ઞાનિક( રોગ), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

### **(છ) મગફળીમાં મૂળ ગાંઢ અને થડના કોહવારાનું નિયંત્રણ**

આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મગફળી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, મગફળીના પાકમાં આવતા મૂળ ગાંઢ (કૃમિ) અને થડના કોહવારાના રોગને અસરકારક રીતે ઘટાડવા માટે ટાલ્કમ આધારીત સ્યુડોમોનાસ ફલુરોસેન્સ નો પાવડર ૨૦ ગ્રામ પ્રતિ કિલો બીજની માવજત સાથે ૨.૫ કિ.ગ્રા. સ્યુડોમોનાસ ફલુરોસેન્સનો પાવડર પ્રતિ હેક્ટરે ચાસમાં આપવો.

(સંશોધન વૈજ્ઞાનિક( રોગ), તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

#### (૪) મોડા ચોમાસામાં પાકની પસંદગી

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારનાં ખેડૂતોને ચોમાસુની શરૂઆત મોડા થવાની પરિસ્થિતિમાં વધુમાં વધુ આવક મેળવવા માટે નીચેનામાંથી પાકની પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે.

પસંદગી માટેનો અગ્રતા ક્રમ :—

ટૂંકાગાળાના પાકો :— ઉભડી મગફળી, તલ, બાજરી, અડદ

લાંબાગાળાના પાકો :— દિવેલા, આડી મગફળી, તુવેર, કપાસ

(સંશોધન વૈજ્ઞાનિક, (કૃષિ વિજ્ઞાન), સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, તરઘડીયા)

#### (૫) મગફળીમાં પોષક તત્ત્વોની વ્યવસ્થા

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારનાં ખેડૂતોને વધુમાં વધુ આવક અને ઉત્પાદન મેળવવા માટે મગફળી આધારીત ફેરબદલીમાં મગફળી પછી મગફળી અથવા તલ અથવા બાજરીનાં પાકમાં સંકલિત પોષક તત્ત્વોની વ્યવસ્થા (જે તે પાકનો ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો રપ ટકા જથ્થો + કાંપોષ્ટ પ ટન/હેક્ટર + દિવેલીનો ખોળ ૫૦૦ કિ.ગ્રा./હેક્ટર + એઝેટોબેક્ટર અને પીએસએમ પ ગ્રામ/કિ.ગ્રા. બીજ માવજત) અપનાવવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક (કૃષિ વિજ્ઞાન), સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, તરઘડીયા)

#### (૬) ચોમાસુ મગફળીમાં રાસાયણિક ખાતર સાથે દિવેલીના ખોળનો ઉપયોગ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ચોમાસુ મગફળી(જીજી-૭) વાવતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, મગફળીના પાકને ભલામણ કરેલ રાસાયણિક ખાતરના ૫૦ ટકા જથ્થાની(નાઈટ્રોજન અને ફોસ્ફરસ ૮.૨૫ : ૧૨.૫૦ કિલો/હે) સાથે ૫૦૦ કિલોગ્રામ દિવેલીનો ખોળ પ્રતિ હેક્ટરે આપવાથી મહત્વમાં ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક, (જમીન વિજ્ઞાન), સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, તરઘડીયા)

#### (૭) વરસાદ આધારીત મગફળીમાં મોલો જીવાતનું નિયંત્રણ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગના વરસાદ આધારીત મગફળી ઉગાડતાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, મોલો (પ્રતિ પાન ૧.૫ માત્રા) અને તડતડીયા (પ્રતિ ત ઉપરનાં પાન ત નિમ્ન ની માત્રા) જીવાત તેની વસ્તીની આર્થિક ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે તેનું અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ કરવા માટે ઇંમીડાકલોપ્રિડ ૧૭.૮ એસ એલ ૦.૦૦૭ ટકા (૪ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા થાયોમિથોક્ષમામ ૨૫ ડબ્લ્યુ.જી. ૦.૦૧ ટકા દવા (૪ મિ.લિ. /૧૦ લિટરપાણી ) અથવા એસીટામાપ્રિડ ૨૦ એસ.પી. ૦.૦૦૪ ટકા દવા (૨ મિ.લિ. /૧૦ લિટર પાણી) છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક, (કિટક), સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, તરઘડીયા)

### (૩) વરસાદ આધારીત મગફળીમાં ચુસિયા પ્રકારની જીવતોનું નિયંત્રણ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગના વરસાદ આધારીત મગફળી ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, ચુસિયા પ્રકારની જીવતો મોલો, લીલા તડતડીયા, શિપ્સ તથા રોગ ચિતરી અને ગોરૂના અસરકારક અને સંયુક્ત નિયંત્રણ માટે જંતુનાશક અને ફૂગનાશક દવાના મિશ્રણનો છંટકાવ શિડયુલ-૧ મુજબ ડાયમિથોએટ ૩૦ ઈસી દવા ૧૦ મિ.લિ. + મેન્કોઝેબ ૭૫ ડબ્લ્યુ.પી. ૨૫ ગ્રા./૧૦ લિટર પાણી પ્રમાણે વાવેતર બાદ ૫૫ દિવસે, મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી દવા ૧૦ મિ.લિ. + કાર્બનડાઝીમ ૫૦ ડબ્લ્યુ.પી.૫ ગ્રા./૧૦ લિટર વાવેતર બાદ ૫૦ દિવસે અને એન્ડોસલ્ફાન ૫૫ ઈસી દવા ૨૦ મિ.લિ. + મેન્કોઝેબ ૭૫ ડબ્લ્યુ.પી. ૨૫ ગ્રામ/૧૦ લિટર વાવેતર બાદ ૫૫ દિવસે અથવા શિડયુલ-૨ મુજબ થાયોમિથોક્ષામ ૨૫ ડબ્લ્યુ.જી. ૪ મિ.લિ.+ હેક્ઝાકોનાઝોલ ૨૫ ઈ.સી. ૪ મિ.લિ. /૧૦ લિટર પાણી પ્રમાણે વાવેતર બાદ ૫૫ દિવસે, એસીટામાપ્રિડ ૨૦ એસ.પી. ૨ ગ્રામ + કલોરોથેલોનીલ ૭૫ ડબ્લ્યુ.પી. ૨૫ ગ્રા./૧૦ લિટર પાણી વાવેતર બાદ ૫૦ દિવસે અને ઈમીડાકલોપ્રિડ ૧૭.૮ ટકા એસ. એલ. ૪ મિ.લિ. + કાર્બનડાઝીમ ૫૦ ડબ્લ્યુ.પી. ૫ ગ્રા. + મેન્કોઝેબ ૭૫ ડબ્લ્યુ.પી. ૨૫ ગ્રા./૧૦ લિટર પાણી વાવેતર બાદ ૫૫ દિવસે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક(કિટક), સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, તરઘડીયા)

### (૪) ખારા પાણીમાં મગફળીની જાતની પસંદગી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળું મગફળીની જાત દા.ત. જીજી-૪, જીજી-૫, જીજી-૬ ઉગાડતા ખેડૂતો

ર ડેસી સાયમન્સની ખારાશવાળા પાણીનો પિયત માટે ઉપયોગ કરી શકે છે.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

### ૩.૨ દિવેલા

#### (ક) પિયત દિવેલામાં સલ્ફર સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ

આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં પિયત દિવેલા ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે વધારે ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવવા દિવેલાનાં પાકને ૨૦ કિ.ગ્રા. સલ્ફર પ્રતિ હેક્ટારે જીપ્સમનાં રૂપમાં (૧૫૦ કિ./ હે.) અને ભલામણ કરેલ નાઈટ્રોજન ૭૫ કિ.ગ્રા. અને ફોસ્ફરસ ૪૦ કિ.ગ્રા/ હેક્ટારે યુરીયા અને ડી.એ.પી. નાં રૂપમાં આપવો. અથવા દિવેલાનાં પાકને ભલામણ કરેલ રાસાયણિક ખાતર (૭૫ : ૪૦ કિ.ગ્રા. નાં ફો./હે.) યુરીયા અને સીગલ સુપર ફોસ્ફેટ નાં રૂપમાં આપવો.

(સંશોધન વૈજ્ઞાનિક(કૃષિ વિજ્ઞાન), તેલીબિયા સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

#### (ખ) ચોમાસુ દિવેલાના વાવેતર માટે જમીનની તૈયારી

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, ચોમાસુ અસ્તુમાં દિવેલાનું મહત્વમાં ઉત્પાદન અને ચોખ્ખુ વળતર મેળવવા માટે હળથી ખેડૂતોને સાથે જમીન તૈયાર કરી ૬૦ × ૬૦ સે.મી ના અંતરે વાવેતર કરવું.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

### ૩.૩ તલ

#### (ક) તલના પાનના ટપકાનું નિયંત્રણ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, તલના પાન ટપકાના રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૦.૦૨૫ ટકા (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણીમાં અથવા સીમોકજેનીલ ૮ ડબલ્યુ.પી. + મેન્કોરેબ ૬૪ ડબલ્યુ.પી. ૦.૧ ટકા (૨૦ ગ્રામ/૧૦ લિટર) પાણીમાં મેન્કોરેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૫ ગ્રામ ૧૦ લિટર/ પાણી ) મિશ્ર કરી વાવેતર બાદ ૪૦ દિવસે અને ત્યાર બાદ ૧૨ દિવસનાં અંતરે છંટકાવ કરવા.

(સંશોધન વૈજ્ઞાનિક, (રોગ), સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જૂક્કુ, તરઘડીયા)

#### (ખ) તલના પાન વાળનારી ઈયળનું નિયંત્રણ

ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસુ ઋતુમાં તલનું વાવેતર કરતા ખેડૂતોને અસરકારકઅને આર્થિક વળતરયુક્ત બૈઠાની માખીના નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન ઉપ ઈ.સી. ૦.૦૭ ટકા(૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં)ત્રણ છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ વનસ્પતિક વૃદ્ધિ વખતે (૩૦ દિવસે)બીજો છંટકાવ ફૂલ અવસ્થાએ (૪૫ દિવસે) અને બૈઠા બેસતી વખતે (૬૦ દિવસે) એમ ત્રણ છંટકાવની ભલામણ કરવામાં આવે છે.

(સહ સંશોધન વૈજ્ઞાનિક(ક્રીટક) કૃષિ સંશોધન કેન્દ્ર, જૂ.કુ.યુ. અમરેલી)

#### (૪) કઠોળ પાકો

##### ૪.૧ અડદ

#### (ક) અડદના પાનના ટપકાનું નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે અડદના પાનના ટપકાના રોગનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે રોગની શરૂઆત થયે પ્રોપીકોનાઝોલ ૦.૦૨૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) અથવા હેકઝાકોનાઝોલ ૦.૦૦૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) નાં ત્રણ છંટકાવ ૧૫ દિવસનાં અંતરે કરવા.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુ, જૂનાગઢ)

#### (૫) રોકડીયા પાકો

##### ૫.૧ કપાસ

#### (ક) કપાસનું વાવેતર અંતર અને રાસાયણિક ખાતર

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં પિયત આધારીત ખેતીમાં બીટી કપાસ આરસીએચ-૨ ઉગાડતા ખેડૂતોને કપાસનું પ્રતિ હેકટરે વધારે ઉત્પાદન અને ચોખી આવક મેળવવા માટે ૧૨૦ ×૪૫ સે.મી. ના અંતરે વાવવાની તથા ૧૬૦ કિલો પ્રતિ હેકટરના દરે નાઈટ્રોજન આપવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક(કપાસ), કપાસ સંશોધન કેન્દ્ર, જૂક્કુ જૂનાગઢ)

## (ખ) કપાસમાં પોટેશીયમ નાઈટ્રોટનો ઉપયોગ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં પિયત આધારીત ખેતીમાં બીટી કપાસ વીઆઈસીએચ—૫ ઉગાડતા ખેડૂતોને કપાસનું પ્રતિ હેક્ટરે વધારે ઉત્પાદન (૨૭૪૬ ક્રિ/હે), ચોખ્ખી આવક રૂ.૪૮૧૭૮ / હે) અને આવક —ખર્ચનો ૧.૬૫ મેળવવા માટે ત ૨૮ ટકા પોટેશીયમ નાઈટ્રોટના ત્રણ છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક(કપાસ), કપાસ સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ જૂનાગઢ)

## (ગ) કપાસના પાનના ખૂણિયા ટપકાં રોગનું નિયંત્રણ

આથી દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાકમાં આવતા ખૂણિયા ટપકાં રોગના અસરકારક અને પોષણાક્ષમ નિયંત્રણ માટે ટાલકમ આધારીત સ્યુડોમોનાસ ફલુરોસન્સ (પી.એફ—૧) ૧૦ ગ્રામ દવાની એક કિલો બીજ માવજત આપી વાવેતર કરવું અને વાવેતર પછી ૩૦,૫૦,૭૦ અને ૬૦ દિવસના અંતરે ૦.૨ ટકા પ્રમાણેના ચાર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

(મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક(વનસ્પતિ રોગ), કપાસ સંશોધન કેન્દ્ર, જૂક્કુયુ, જૂનાગઢ)

## (દ) બાગાયતી પાકો

### ૬.૧ ગુંદો

#### (ક) ગુંદામાં છાટણી

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વાતાવરણમાં ગુંદા ફળનું વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે ગુંદાની ચારેય બાજુઓની એક વર્ષ જુની ડાળીઓની લંબાઈના ૭૫ ટકા જેટલી છાટણી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવાની ભલામણ કરવામાં આવે છે.

(પ્રાધ્યાપક અને વડા, બાગાયતશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

### ૬.૨ સીતાફળ

#### (ક) સીતાફળને રાસાયણિક ખાતર

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે સીતાફળના સિંઘણ જાતના પુખ્ત ઉમરના જાડને ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન + ૫૦ ગ્રામ ફોસ્ફરસ + ૨૫ ગ્રામ પોટાશ + ૨.૫ ક્રિ.ગ્રા. એર્નીનો ખોળ ચોમાસામાં પ્રથમ વરસાદ વખતે આપી દેવાથી વધુ ફળ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવી શકાય છે.

(પ્રાધ્યાપક અને વડા, બાગાયતશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

### ૬.૩ આંખો

#### (ક) સારી ગુણવત્તાવાળા અને વેચાણલાયક પાકેલા ફળો મેળવવા

આથી ભલામણ કરવામાં આવે છે કે તાજા પરીપક્વ કેસર કેરીના ફળોને ઈથરેલ ૭૫૦ મિ.ગ્રા. પ્રતિ લીટર પાણીના દ્રાવણમાં પાંચ મીનીટ સુધી બોળી ઓરડાના તાપમાને રાખવાથી નવમા દીવસે સારી ગુણવત્તાવાળા અને વેચાણલાયક પાકેલાં ફળો વધુ જથ્થામાં મેળવી શકાય છે.

(પ્રાધ્યાપક અને વડા, બાગાયતશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

## (ખ) આંબામાં ભૂકી છારાનું નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આંબાની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ભૂકીછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે મોર આવવાની શરૂ થયેથી હેકાકોનાઝોલ ૦.૦૦૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) અથવા પ્રોપીકોનાઝોલ ૦.૦૨૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) નાં ત્રણ છંટકાવ ૨૦ દિવસનાં અંતરે કરવા.

(પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

## ૬.૪ નાળીયેરીમાં સેન્ટ્રિય ખાતર ઢારા પોષક તત્વોનો ઉપયોગ

(ક) આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના નાળીયેરી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે નાળીયેરીની પણ્ણિમ કિનારાની ઉચ્ચી જાતમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો અડધો જથ્થો એટલે કે ના.ફો.પો. ૨૦૦-૧૬૦-૭૫૦ ગ્રામ પ્રતિ જાડ પ્રતિ વર્ષ સાથે ૫ કિલો એરંડીનો ખોળ બે સરખા હપ્તામાં (જૂન અને ઓક્ટોબર) આપવાથી નાળીયેરના ઉત્પાદનમાં વધારા સાથે ફળની ગુણવત્તા અને જમીનની ફળદુપતામાં સુધારો થાય છે.

(સંશોધન વૈજ્ઞાનિક(બાગાયત), કૃષિ સંશોધન કેન્દ્ર, (ફળપાકો), જૂક્કુયુ, મહુવા)

## (જ) ફૂલ પાકો

### ૭.૧. સેવંતી

#### (ક) સેવંતીની આઈ.આઈ.એચ.આર.-૬ જાત વાવવાની ભલામણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતો કે જેઓ સેવંતી ફૂલનો પાક ઉગાડવામાં રસ ધરાવે છે તેઓ ને સલાહ આપવામાં આવે છે કે ફૂલોના વધુ ઉત્પાદન સાથે વધુ નાણાનું વળતર મેળવવા માટે સેવંતીની આઈ.આઈ.એચ.આર.-૬ જાત પસંદ કરવી.

(પ્રાધ્યાપક અને વડા, બાગાયતશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

## (લ) શાકભાજીના પાકો

### ૮.૧ કારેલા

#### (ક) કારેલા તળછારાનું નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કારેલાના તળછારાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે રોગની શરૂઆત થયે મેટાલેક્શીલ એમેઝેડ ૦.૧૦ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૪ ગ્રામ) અથવા કલોરોથેલોનીલ ૦.૧૦ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૩.૩૦ ગ્રામ) અથવા ફોઝેટાઇલ એમેલ ૦.૧૦ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૨.૫૦ ગ્રામ) નાં ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

(પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂક્કુયુ, જૂનાગઢ)

## ૮.૨ રીગણ

### (ક) શિયાળુ રીગણમાં નીદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગના શિયાળુ ઋતુમાં રીગણનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે રીગણનું વધુ ઉત્પાદન, અસરકારક નીદણ નિયંત્રણ અને ચોખ્યુ વળતર મેળવવા માટે રીગણની ફેરરોપણી બાદ ૨૦, ૪૦, ૬૦ અને ૮૦ દિવસે હાથ નિંદામણ અને ૨૦, ૪૦ અને ૬૦ દિવસે આંતરખેડ કરી પાકને નિંદણ મુક્ત રાખવો.

#### અથવા

મજુરોની અછતની પરિસ્થિતિમાં શિયાળુ ઋતુમાં રીગણનું વધુ ઉત્પાદન, અસરકારક નીદણ નિયંત્રણ અને ચોખ્યુ વળતર મેળવવા માટે પેન્નીમેથાલીન ૦.૮૦ કિ.ગ્રા./હે દવાને ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી ફેરરોપણી બાદ પરંતુ નીદણ ઉગે તે પહેલા છંટકાવ કરવો. ફેરરોપણી બાદ ૪૫ દિવસે એક હાથ નિંદામણ અને આંતરખેડ કરવી ત્યાર બાદ તૂરત જ પેન્નીમેથાલીન ૦.૮૦ કિ.ગ્રા./હે પ્રમાણે પિયત પાણી સાથે આપવી.

(પ્રાધ્યાપક અને વડા, કૃષિ વિજ્ઞાન વિભાગ, જૂક્ક્યુ, જૂનાગઢ)

### (ખ) રીગણમાં જુદી જુદી જીવાતોનું જૈવિક નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રીગણનાં પાકમાં આવતી જુદી જુદી જીવાતો (તડતડીયા, સફેદમાખી અને દુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ) ના જૈવિક જંતુનાશક આધારિત અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે મેટારીઝ્યમ એનીસોષ્ટી ૧.૦ કિ.ગ્રા./હે. સાથે એન્ડોસલ્ફાન ઉપ ઈસી ૦.૦૩૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિલિ દવા) અથવા બીવેરીયા બાસીયાના ૧.૦ કિ.ગ્રા./હે. સાથે એન્ડોસલ્ફાન ઉપ ઈસી ૦.૦૩૫ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિલિ દવા) અથવા મેટારીઝ્યમ એનીસોષ્ટી ૨.૦ કિ.ગ્રા./હે. ના બે છંટકાવ, પ્રથમ છંટકાવ જીવાતો નો ઉપદ્રવ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ ત્યારબાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે.

(પ્રાધ્યાપક અને વડા, કિટકશાસ્ત્ર વિભાગ, જૂક્ક્યુ, જૂનાગઢ)

## ૮.૩ દુંગળી

### (ક) દુંગળીમાં શ્રીપસનું નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં શિયાળુ કંદા હેતુ માટેના દુંગળી પાકમાં શ્રીપસ જીવાતના અસરકારક અને અર્થક્ષમ જૈવિક જંતુનાશક આધારિત નિયંત્રણ માટે બીવેરીયા બાસીયાના ૨ કિ.ગ્રા./હે. અથવા મેટારીઝ્યમ એનીસોષ્ટી ૧.૫ કિ.ગ્રા./હે. પ્રમાણે બે છંટકાવ, પ્રથમ છંટકાવ શ્રીપસનો ઉપદ્રવ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ ત્યારબાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે.

(પ્રાધ્યાપક અને વડા, કિટકશાસ્ત્ર વિભાગ, જૂક્ક્યુ, જૂનાગઢ)

### (ખ) કૃષિ ઈજનેરી

### (ક) સોલર ફોટોવોલ્ટેક ગ્રીનહાઉસ વેન્ટીલેશન સીસ્ટમ

આથી ગ્રીનહાઉસ ઉપયોગમાં લેતા ખેડૂતો તેમજ બનાવનાર (મેન્યુફેક્ચર્સ ) ને વિઘૃત ખોરંભના કારણે વાતાવરણ વેન્ટીલેશનમાં પડતી મુશ્કેલીઓ નિવારવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ " સોલર ફોટોવોલ્ટેક ગ્રીનહાઉસ વેન્ટીલેશન સીસ્ટમ" નો ઉપયોગ કરવાની આથી ભલામણ કરવામાં આવે છે.

(પ્રાધ્યાપક અને વડા, ઉર્જા વિભાગ, કૃષિ ઈજનેરી કોલેજ, જૂક્ક્યુ, જૂનાગઢ)

## (ખ) બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક મલ્ચનો દુંગળીના પાકમાં ઉપયોગ

આથી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨૦ માઈક્રોની કાળી બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક મલ્ચનો દુંગળીના પાકમાં ઉપયોગ કરવાથી ૧૫ ટકા ઉત્પાદન વધે છે તેમજ ૫૦ થી ૬૨ ટકા નીદણ ઘટે છે. પાકની કાપણી પછી ખેતરમાં ખેડ કરતાં આ મલ્ચ માટીમાં ભળી જાય છે અને તેના નિકાલની જરૂર પડતી નથી.

(પ્રાધ્યાપક અને વડા, ઉર્જા વિભાગ, કૃષિ ઈજનેરી કોલેજ, જુક્કુયુ, જૂનાગઢ)

## (ગ) ઘઉમાં અંકુરણ અને જુસ્સો વધારે મેળવવા

બીયારણ માટે ઘઉ ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામા આવે છે કે, સ્વયંમ સંચાલીત કમ્બાઇન હાર્વેસ્ટર કરતા થ્રેસર વાપરવામા આવે તો ઘઉમાં અંકુરણ અને જુસ્સો વધારે સારા મળે છે.

(પ્રાધ્યાપક અને વડા, એશ્રીકલ્યરલ પ્રોસેસ એન્જીનીયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, )

## (ઘ) સુકવણી યંત્ર દ્વારા શાકભાજીની સુકવણી

શાકભાજીની સુકવણી કરતા ઉધોગકારો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વીકસાવાયેલ કૃષિ જન્ય ઉપ-પેદાશો પર ચાલતા સુકવણી યંત્ર દ્વારા ગાજરનું છીણ તથા પતરી, કોણીના પાંદડા, ફલાવરના ટુકડા, ટમેટાની પતરી અને આખા લીલા મરચાની સુકવણી કરવા માટે નીચે જણાવેલ પરિબળો રાખવાની ભલામણ કરવામાં આવે છે.

૧. સુકવતી ગરમ હવાનું તાપમાન	:	૫૧ થી ૫૫ ડિગ્રી સેલ્સીયસ
૨. સુકવતી ગરમ હવાનો વેગ	:	૧.૫ મીટર પત્ર સેકન્ડ
૩. સુકવણી સ્તરની જાડાઈ	:	૮ સેન્ટીમીટર
૪. બળતણાનો જથ્થો	:	૫.૫૦ કીલો ગ્રામ પત્ર કલાક

(પ્રાધ્યાપક અને વડા, એશ્રીકલ્યરલ પ્રોસેસ એન્જીનીયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, )

## (ચ) સૂકી ખેતીમાં ઉભડી મગફળીની વાવેતર પદ્ધતિ

ઉત્તર સોરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના સૂકી ખેતી પરિસ્થિતિમાં ઉભડી મગફળી (જીજી-૫) નું વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ હેકટરે મહત્તમ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા તેમજ જમીનનું ધોવાણ અટકાવવા અને વહી જતા પાણીને રોકવા માટે મગફળી જી.જી.૫ ને ૪૫ સે.મી. ના ધોરીયા અને ૬૦ સે.મી. ના પહોળા કયારામા ઉ હાર રાખીને ૨ હાર વચ્ચે ૩૦ સે.મી. નાં અંતરે વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.

(સંશોધન વૈજ્ઞાનિક, (કૃષિ ઈજનેરી), સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુક્કુયુ, તરઘડીયા)

## (૧૦) પશુપાલન

### (ક) ધઉનાં પરાળની યુરિયા પ્રક્રિયા

સૌરાષ્ટ્રનાં ખેડૂતો—પશુપાલકો માટે ભલામણ કરવામાં આવે છે કે ગીર વાછરડીઓનાં આહારમાં મગફળી પાલાના બદલામાં, ૪ ટકા યુરિયા પ્રક્રિયા આપેલ ધઉનું પરાળ ૧૮ ટકા વધુ શારીરિક વૃદ્ધિ દર તથા એકમ વૃદ્ધિ દર દીઠ ૨૭ ટકા ઓછા ખર્ચ સાથે વાપરી શકાય છે.

(સંશોધન વैજ્ઞાનિક(અનીમલ જીનેટીક્સ), પશુ ઉછેર કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

### (ખ) દૂધાળ ગીર ગાયોને ખોરાકમાં ધઉનું પરાળ

દૂધાળ ગીર ગાયોને દૈનિક ખાઈ શકે તેટલું ધઉનાં પરાળ તથા ૫ કિલો લીલી જુવારની સરખામણીએ, ૪ ટકા યુરિયા પ્રક્રિયા આપેલ ધઉનાં પરાળ પર નિભાવી ૧૭૮ ટકા વધુ વળતર સાથે દૈનિક ૩.૪ લિટર દૂધ મેળવી વાપરી શકાય છે.

(સંશોધન વैજ્ઞાનિક(અનીમલ જીનેટીક્સ), પશુ ઉછેર કેન્દ્ર, જૂક્યુ, જૂનાગઢ)

## (૧૧) મત્સ્ય પાલન

### (ક) મીઠા પાણીની છીપોની સ્થળાંતર પદ્ધતિ નિર્ધારીત કરવા

મત્સ્ય ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે મીઠા પાણી છીપ (લેમેલીડેન્સ કોરીએન્સ) ને સૌરાષ્ટ્ર—કચ્છ વિસ્તારમાં આઠ કલાકની રસ્તા માર્ગે સ્થળાંતર કરવા માટે પલાણેલા ગુણીયાનો ઉપયોગ હિતાવહ છે.

(આચાર્યશ્રી, મત્સ્ય પાલન મલા વિદ્યાલય, જૂ.કૂ.યુ., વેરાવળ )

### (ખ) વૈવિધ્ય સેલીનીટી (ખારાશ) ધરાવતા પાણીમાં આર્ટીમીયાના સીસ્ટ (સ્તર કવચયુક્ત ઈડા) ઉત્પાદન

મીઠાના અગરીયા તેમજ મત્સ્ય ઉંધેરકરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, પાણીની ખારાશ (સેલીનીટી) ૧૬૦ પીપીટી રાખવાથી આર્ટીમીયાના સીસ્ટનું વધુ ઉત્પાદન મેળવી શકે છે.

(સંશોધન અધિકારી, મત્સ્ય સંશોધન કેન્દ્ર, જૂ.કૂ.યુ. ઓખા )